

દિવાળી ચોપડાપૂજન સૂચના

તા.૧૫/૧૧/૨૦૨૦ને રવિવારના રોજ દિવાળીનો પવિત્ર દિવસ છે. દર વર્ષે વેપારીબંધુઓને દિવાળીના દિવસે ચોપડાપૂજનના પ્રોગ્રામનો પ્રત્યક્ષ લાભ લેતા હોય છે અને શ્રીજી મહારાજને પોતાની પેઢીના કર્તા હોય છે. પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારીના કારણે દેશ વિદેશના તમામ વેપારીબંધુઓને ચોપડાપૂજનનો ઓનલાઈન લાભ મળશે.

ચોપડાપૂજનનો લાભ લેવા માટે તમામ સભ્યોએ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જેમાં તમામ વેપારી હરિભક્તોને સવારે ૭:૩૦ થી ૮:૩૦ ઓનલાઈન ચોપડાપૂજનનો લાભ મળે તે રીતે આયોજન કરેલ છે. જેની વિગતે માહિતી નીચે મુજબ છે. ચોપડાપૂજનમાં લાભ લેવા માટે તમામ હરિભક્તોએ જે તે સેન્ટરના નજીકના SMVSના મંદિરમાં લાભ લેવા માટે જવાનું રહેશે અને ત્યાં જ ચોપડાપૂજનનો લાભ લેવાનો રહેશે. પૂ.સંતો દ્વારા ચોપડાપૂજનના પ્રોગ્રામનો લાભ મળશે.

• હરિભક્તો માટેની સૂચના

1. દેશ-વિદેશના જે હરિભક્તોએ ચોપડાપૂજનમાં લાભ લેવાનો હોય તેમણે ગુગલ ફોર્મમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજીસ્ટ્રેશન માટેની લિંક : <https://forms.gle/B742rQLhNxSUN1K96>
2. સરકારશ્રીના આદેશ મુજબ તમામ હરિભક્તોએ ફરજિયાત માસ્ક પહેરીને આવવાનું રહેશે. તમામ મંદિરોમાં પણ સાવચેતીના પગલાં લેવામાં આવશે. મંદિરમાંથી જે વ્યવસ્થા કરવામાં આવે તેમાં સહકાર આપવાનો રહેશે.
3. તા.૧૫/૧૧/૨૦૨૦, રવિવારના રોજ સવારે ૭:૩૦ વાગ્યે ચોપડાપૂજનનો પ્રારંભ થશે. તેથી મોડામાં મોડા સવારે ૭:૧૫ સુધીમાં મંદિરે પહોંચી જવાનું રહેશે.
4. ધોતી-ઉપરણી પહેરીને ચોપડાપૂજનના પ્રોગ્રામમાં લાભ લેવાનો રહેશે. ધોતી-ઉપરણી લઈને મંદિરે જવાનું રહેશે.
5. ચોપડાપૂજનના પ્રોગ્રામનો લાભ લેવા માટેની સામગ્રી નીચે મુજબ છે. જે સામગ્રી લઈને મંદિરે લાભ લેવા માટે આવવાનું રહેશે.

1. પૂજન માટેના ચોપડા

2. બેસવા માટેનું આસન

3. થાળી-1

4. વાટકી-1

5. લોટો-1

6. ચમચી-1

7. શ્રીફળ-1

8. નાડાછડી

9. અબીલ

10. ગુલાલ

11. કંકુ

12. ચોખા

13. પડિયા

14. સોપારી (ચોપડાદીઠ એક)

15. નાગરવેલના પાન (ચોપડાદીઠ એક)

16. દિવેટ-૩

6. જે શહેરમાં સંસ્થાનું મંદિર કે સત્સંગ કેન્દ્ર નજીકમાં ન હોય અને મંદિર કે સત્સંગ કેન્દ્રથી ૧૦૦-૨૦૦ કિલોમીટર દૂર રહેતા હરિભક્તોએ પોતાના ઘરેથી ચોપડાપૂજનનો લાભ લેવાનો રહેશે. આ હરિભક્તોએ ચોપડાપૂજનની વિગતે માહિતી તેમજ સ્ટીકર માટે નજીકના સેન્ટરના અગ્રેસરો તેમજ પૂ.સંતોનો સંપર્ક કરવાનો રહેશે. તેમને સેન્ટરમાંથી ચોપડાપૂજનના આગલા દિવસે Email કે Whatsapp દ્વારા વિડીઓ એપ્લીકેશનમાં જોડાવા માટેની લિંક મળશે. મંદિર નજીક હોય તે મુકતોએ ફરજિયાત મંદિરે જ લાભ લેવા માટે આવવાનું રહેશે. અગાઉથી લિંક પ્રમાણે વિડીઓ એપ્લીકેશન ડાઉનલોડ કરવી અને વ્યવસ્થિત ઈન્ટરનેટની સગવડ કરી દેવી.

- વધુ માહિતી માટે સેન્ટરના અગ્રેસરનો સંપર્ક કરવો.